

RAN-2501001204010007 / 2501000104033071
S. Y. B. A. (Sem.-IV) Examination April - 2026
Economics Major - VIII
Public Economics
[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book (2) જમણી બાજુના અંક પ્રશ્નના પૂરા ગુણ દર્શાવે છે. Figures to the right indicate the full marks of the question.	Seat No.: Student's Signature
---	--

- પ્ર. 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (કોઈપણ પાંચ) 10**
1. પ્રગતિશીલ કરવેરા એટલે શું?
 2. અંદાજપત્ર એટલે શું?
 3. કરદાનક્ષમતા એટલે શું?
 4. જાહેર દેવું એટલે શું?
 5. રાજકોષીય ખાધ એટલે શું?
 6. જાહેર ખર્ચ ના સિધ્ધાંતો જણાવો
 7. જાહેર વસ્તુ એટલે શું?
- પ્ર. 2. અધિકત્તમ સામાજિક કલ્યાણ નો સિધ્ધાંત મર્યાદા સહિત સમજાવો. 13**
- અથવા**
- (A) કરસંપાત ને અસર કરતાં પરિબળો જણાવો. 6
- (B) લેક્સર વક્રનો ખ્યાલ સમજાવો. 7
- પ્ર. 3. જાહેર દેવાના કારણો સમજાવો અને તેના લાભાલાભ ની ચર્ચા કરો. 13**
- અથવા**
- (A) જાહેર ખર્ચના હેતુઓ સમજાવો. 6
- (B) પ્રો. વેગ્નરના જાહેર ખર્ચ અંગેના સિધ્ધાંતની ચર્ચા કરો. 7
- પ્ર. 4. ટૂંકનોંધ લખો. (કોઈ પણ બે) 14**
1. જાહેર અર્થવિધાન અને ખાનગી અર્થવિધાન વચ્ચેનો તફાવત
 2. વસ્તુઓ અને સેવાઓ પરનો કર (GST)
 3. જાહેર ખર્ચ ની અસરો.
 4. જાહેર દેવાની અસરો

ENGLISH VERSION

- Q. 1. Answer the following questions briefly. (Any five) 10**
1. What is progressive taxation?
 2. What is budget?
 3. What is taxable capacity?
 4. What is public debt?
 5. What is fiscal deficit?
 6. Write the principles of public expenditure.
 7. What is public good?
- Q. 2. Explain the theory of maximum social advantages with limitation 13**
- OR**
- (A) State the factor affecting on tax incidence. **06**
- (B) Explain the concept of the laffer curve **07**
- Q. 3. Explain the causes of public debt and discuss its advantages and disadvantages. 13**
- OR**
- (A) Explain the objective of public expenditure **06**
- (B) Explain Wagner's theory of Public Expenditure. **07**
- Q. 4. Write short notes. (Any two) 14**
1. Difference between public finance and private finance
 2. Goods and service tax (GST)
 3. Effect of public expenditure.
 4. Effect of public debt
-